



**R I President**  
Rtn. Stephanie Urchik



**Dist. Governor**  
Rtn. Tushar Shah



**President**  
Rtn. Divyesh Sodha  
+91 93278 04131



**Club Secretary**  
Rtn. Utsav Thakkar  
+91 99786 59418



**Bulletin Editor**  
Rtn. Jayesh Pattani  
+91 9825047696

Rotary Club of Porbandar | Year 2024-25 | Bulletin No. 6 | Dt. 07-12-2024

## ➔ ROTARY FOUR WAY TEST

### OF THE THINGS WE THINK, SAY OR DO

1. Is it the TRUTH?
2. Is it FAIR to all concerned?
3. Will it build GOODWILL and BETTER FRIENDSHIPS?
4. Will it be BENEFICIAL to all concerned?



## PRESIDENTIAL MESSAGE



Dear Rotarians,

As we enter December, Rotary's Disease Prevention and Treatment Month, we are reminded of our vital role in promoting health and well-being. Our longstanding initiatives, such as

providing nutrition kits to TB patients and supporting the healthcare infrastructure, are a testament to our commitment to this cause.

This month, let us reaffirm our dedication to building healthier communities. Whether by spreading awareness, supporting medical projects, or encouraging preventive healthcare, every effort counts. Together, we can combat disease and enhance the quality of life for many.

I invite all of you to join hands in our ongoing projects and upcoming events like Open Gujarat Karaoke Singing competition. Let us also extend our support to the Rotary Foundation, as every contribution furthers our mission of service above self. Let's close the year with the spirit of service and a renewed pledge to make a difference.

આપનો,  
રો. દિવ્યેશ સોઢા  
પ્રમુખ, રોટરી ક્લબ પોરબંદર  
૨૦૨૪-૨૫

રો. ઉત્સવ ઠક્કર  
સેક્રેટરી, રોટરી ક્લબ પોરબંદર  
૨૦૨૪-૨૫

# ADVERTISEMENT

PRECIOUS MOMENTS OF LIFE

**Hemant Khatoowala**  
26-12-1977  
9328116832



**Dhaval Parmar**  
27-12-1981  
9377328800

**Binduben Shah**  
04-12-1949  
9328727598

**Utsav Thakrar**  
30-12-1986  
9978659418



**04-12-1997**  
**Pritesh & Dipti**  
**Lakhani**

**04-12-1994**  
**Dipal & Dimple**  
**Chandarana**

**07-12-2020**  
**Kushal & Mittal**  
**Raichura**

**04-12-1997**  
**Ketan & Krishna**  
**Bharaniya**

**08-12-2020**  
**Kashyap & Vaibhavi**  
**Gandhi**

**06-12**  
**Hemant & Deepali**  
**Khatoowal**

**08-12-1994**  
**Ashwin & Kavita**  
**Cholera**


**07-12-2012**  
**Chintan & Ishita**  
**Raithatha**

**09-12-2005**  
**Sandip & Pooja**  
**Raninga**

**07-12-2020**  
**Dharmendra & Jayshree**  
**Dholakiya**

**10-12-1990**  
**Harishchandra & Hansa**  
**Gohel**

## 7 Lessons from “How to Be a Leader



15 Minutes a Day to Establish Communication, Resiliency, Creativity, and Humility” by David M. Cote:

1. **Prioritize Communication** Cote emphasizes that effective communication is the cornerstone of leadership. Leaders should strive to be clear, concise, and open in their communication, fostering an environment where team members feel comfortable sharing ideas and feedback.

2. **Cultivate Resiliency** The book highlights the importance of resiliency in leadership. Cote suggests that lead-

ers should not only develop their own resilience but also encourage their teams to bounce back from setbacks, viewing challenges as opportunities for growth.

3. **Encourage Creativity** Cote advocates for creating a culture that values creativity. Leaders should inspire innovation by allowing team members to explore new ideas and approaches, which can lead to improved problem-solving and adaptability.

4. **Practice Humility** A key lesson is the significance of humility in leadership. Cote argues that great leaders recognize their limitations and are open to learning from others, fostering a collaborative atmosphere that values diverse perspectives.

5. **Invest in Self-Development** Cote stresses the need for leaders to commit to continuous self-improvement. By dedicating just 15 minutes a day to personal development—whether through reading, reflection, or skill-building—leaders can enhance their effectiveness over time.

6. **Lead by Example** The book emphasizes that leaders should model the behavior they wish to see in their teams. By demonstrating integrity, accountability, and a strong work ethic, leaders can inspire their team members to follow suit.

7. **Build Strong Relationships** Cote highlights the importance of building strong relationships within the team. Effective leaders invest time in understanding their team members, fostering trust and collaboration, which ultimately leads to a more cohesive and motivated workforce. These lessons collectively provide a practical framework for developing essential leadership qualities that can lead to greater success and fulfillment in both personal and professional realms.

# Rotary month of December Celebrated for

DECEMBER IS



*Photo by Joseph Tun Meng Lim, © Rotary Club of Miri. Design layout by Gilbert Lim.*

## DISEASE PREVENTION AND TREATMENT MONTH

*Disease prevention and treatment takes on many forms, supporting studies to helping immunize people to improving drinking water and the sanitation infrastructure.*



TAKE ACTION: Join a Project

**P**aradise  
Photography

Make Your  
Precious Occasion  
Memorable  
WITH US

**DEVANG  
BHUNDIYA  
9825875359**

PAST MONTH PROJECTS/EVENTS/MEMORIES

રોટરી ક્લબ ઓફ પોરબંદર અને ઈનર વ્હીલ ક્લબ ઓફ પોરબંદર અને ઈનર વ્હીલ ક્લબ ઓફ દિલ્હી એચિવર્સ ડિસ્ટ્રીક્ટ ૩૦૧ના સંયુક્ત ઉપક્રમે




સરકારશ્રીની નિઃક્ષય યોજના અંતર્ગત અ-ક્ષય પ્રોજેક્ટનું ૨૫ મુ, માસિક પ્રોટીન યુક્ત આહાર કીટનું વિતરણ તા. ૧૫ નવેમ્બર, શુક્રવારે બપોરે ૪:૩૦ કલાકે નટવરસિંહજી ક્લબ ખાતે જિલ્લા TB Officers ની હાજરીમાં કરવામાં આવેલું. આ પ્રોજેક્ટમાં ૧૦ કીટ માટે IWC Of Delhi Achivers Dist.301 તરફથી અનુદાન મળેલ છે અને ક્લબ પ્રેસિડેન્ટ સ્વાતી શેઠ, સેક્રેટરી સુનિતા સુરી સહિત ૧૪ મેમ્બર આપણા જોઈન્ટ પ્રોજેક્ટમાં હાજરી આપેલ.

રોટરી ક્લબ ઓફ પોરબંદર, ડીસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ, યુવા ચેમ્બર દ્વારા મુંબઈ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ



આજથી ૧૬ વર્ષ પહેલા ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ ૧૦ જેટલા પાકિસ્તાની આતંકીઓ દ્વારા ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી મુંબઈના તાજ હોટલ, લીઓપોલ્ડ કાફે, નરીમન હાઉસ, સી.એસ.ટી રેલવે સ્ટેશન તેમજ ઓબેરોય હોટેલ ખાતે આતંકી હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં પોલીસ જવાનો, એન.એસ.જી કમાન્ડો સહિત કુલ ૧૭૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા જેઓને ગત તા. ૨૬ નવેમ્બરના રોટરી ક્લબ ઓફ પોરબંદર, ડીસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, યુવા ચેમ્બર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં કી-નોટ સ્પીકર તરીકે ઉપસ્થિત રહેલા જાણીતા પત્રકાર દેવાંગ ભૂંડિયા દ્વારા સમગ્ર ઘટનાની વિસ્તૃત માહિતી અપાઈ હતી.

## CROSSWORD PUZZLE



## નિયમ

- \* આ કોમ્પીટીશન ફક્ત રોટરી ક્લબના સભ્યો અને તેમના પરિવાર માટે જ છે.
- \* ભાગ લેનારે તમામ જવાબો સાચા આપવા જરૂરી છે.
- \* તમામ જવાબો નિર્ણાયક દ્વારા તપાસવામાં આવશે
- \* તમામ સાચા જવાબ આપનારમાંથી કોઈ એક લડી વિનરને આપનારી રોટરીની મિટીંગમાં પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવશે
- \* આપનારી મિટીંગમાં લડી ફ્રો સીસ્ટમ દ્વારા વિજેતા નક્કી કરવામાં આવશે

## ઉભી ચાવી

- (૧) ખેડૂત પોતાના ખેતરની આસપાસ કાંટાની ..... કરે છે.
- (૨) વિશેષ, વિશિષ્ટ
- (૩) અંગ્રેજીમાં હા એટલે
- (૪) પર્ણ
- (૫) ઈન્સાફ, ન્યાય
- (૬) ખાંડની ચાસણીમાં ફળ ભેળવીને કરેલો મુરબ્બો
- (૭) વાળ
- (૮) ઘણું ખૂબ
- (૯) ચશ્માનું ચોકકું
- (૧૦) અમુક ચોકકસ સમય કે કાલનો આખો ગાળો
- (૧૧) જીતનું વિરોધી
- (૧૨) ઘણાં શીંગડાવાળો મૃગ
- (૧૩) શતરંજની રમતમાં સિપાઈનું મહોરું
- (૧૪) મૂર્ખ, ઠોઠ

## આડી ચાવી

- (૧) એક જંગલી પ્રાણી
- (૨) એક કહેવત ..... ખોટે તે પડે
- (૪) નાપાસનું વિરોધી
- (૫) સેવક, ચાકર
- (૬) વરના પરણવા જતી વેળાનો સગાંસંબંધીઓનો સાથે નીકળતો સમૂહ
- (૭) કારાગૃહ, બંદીખાનું
- (૮) તમે કીયા તે .....ના ગોરી રાજ
- (૯) તાજુંનું અંગ્રેજી
- (૧૧) હિંમત
- (૧૨) કટાક્ષ
- (૧૩) પ્રેમ, સ્નેહ, હેત
- (૧૪) એક આકાર
- (૧૫) સૂંઠ આમાંથી બને
- (૧૬) આબરૂ, પ્રતિષ્ઠા
- (૧૭) એક રમત

## UPCOMING PROJECTS/EVENTS/MEETINGS

# December - 2024

Sun	Mon	Tues	Wed	Thrus	Fri	Sat
1	2	3	4	5	6	7
8	9	10	11	12	13	14
15	16	17	18	19	20	21
22	23	24	25	26	27	28
29	30	31				

## Upcoming Meetings / Projects:

1. Fellowship: 31st December Night Celebration with DJ, Dance, Music and Games
2. CPR Training at Collages during the month
3. Drawing competition in the last week of December
4. Book reading competition
5. Seminar to create awareness on preservation of natural resources - Water / Electricity
6. Drive to create awareness for organ donation

# Paradise Photography

**SPECIAL OFFER**

**Free** SAVE THE DATE Invitation **Video**  
**Free** SAVE THE DATE Invitation **Poster**  
**Free** 8\*12 Size **Photoframe**

## Devang Bhundiya - 9825875359